

સાપ્તાહિક રાશિભવિષ્ય

તા. ૨૧ જુલાઈથી તા. ૨૭ જુલાઈ, ૨૦૧૭



મેષ (અ.લ.ઇ.)

નોકરિયાત વર્ગ માટે આ સમય લાભદાયી જણાય છે. બઢતીની તક પણ ઊભી થાય. શુભ સમાચાર અવશ્ય મળી શકે તેમ છે. ધંધાકીય બાબતોમાં પણ સાનુકૂળતા સર્જશે. લાંબી વ્યાવસાયિક મુસાફરીનું આયોજન પણ કરી શકાય. દામ્પત્યજીવનના પ્રશ્નો તથા કોર્ટકચેરીના કાર્યમાં ધાર્યા મુજબની સફળતા મળે તેમ છે. તા. ૨૧, ૨૨, ૨૩ લાભપ્રદ દિવસો ગણાય. તા. ૨૪, ૨૫ સફળ દિવસો પસાર થાય. તા. ૨૬, ૨૭ શુભ કાર્ય થઈ શકે.



વૃષભ (બ.વ.ઉ.)

આનંદમય દિવસો પસાર થાય તેવા યોગો જણાય છે. મહત્વની મુસાફરી ફળદાયી નીવડે તેમ છે. નવા સંબંધો થકી લાભ થાય તેમ છે. રચનાત્મક કાર્યો થઈ શકશે. હિતશત્રુઓ ફાવે તેમ નથી. નોકરી-ધંધાના ક્ષેત્રમાં વિચારપૂર્વક નિર્ણયો લેવા હિતાવહ બની રહેશે. તા. ૨૧, ૨૨, ૨૩ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૪, ૨૫ લાભમય દિવસો ગણાય. તા. ૨૬, ૨૭ વિચારપૂર્વક દરેક નિર્ણય લેવો.



મિથુન (ક.ઇ.ધ.)

આવક કરતાં જાવકનું પ્રમાણ વધવા પામશે. આપના ખર્ચાઓ પર અંકુશ મૂકવો પડશે. પરિણામે આર્થિક તંગી ઓછી નડશે. મિત્રો, શુભેચ્છકોની મદદ મળતી રહેશે. ધંધાકીય વિકાસની યોજનાઓ સાકાર બની શકે તેમ છે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. જીવનસાથીનું આરોગ્ય જાળવવું. વિદ્યાર્થીમિત્રોએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૨૧, ૨૨, ૨૩ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૪, ૨૫ લાભકારક દિવસો. તા. ૨૬, ૨૭ આરોગ્ય સંભાળવું.



કર્ક (ડ.ઈ.)

આપનો આ સમય સાનુકૂળ જણાતો નથી. આર્થિક સમસ્યાઓનું નિવારણ શોધવામાં વિલંબ થાય તેમ છે, પરંતુ જેમ જેમ દિવસો વીતતા જશે તેમ તેમ સાનુકૂળ સંજોગોનું નિર્માણ અવશ્ય થશે. વ્યવસાયને લગતી કામગીરીમાં સફળતા મળશે. ગૃહજીવનના પ્રશ્નો પણ ઉકેલાઈ જશે. તંદુરસ્તી જળવાશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૧, ૨૨, ૨૩ પ્રતિકૂળ દિવસો ગણાય. તા. ૨૪, ૨૫ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૨૬, ૨૭ લાભકારક દિવસો ગણાય.



સિંહ (મ.ટ.)

આ સમયગાળામાં આપનો કાર્યબોજ વધવા પામશે. પરિણામે ચિંતા - ઉચાટ - ઉદ્વેગ - ગુસ્સો વગેરે રહ્યા કરશે. મનથી સંયમ તથા ધીરજ રાખવાની જરૂર જણાય છે. નાણાકીય મુશ્કેલીઓ હળવી થતી જણાશે. અલબત્ત, ખર્ચનું પ્રમાણ વધવા ન પામે તે ખાસ જોશો. આરોગ્ય જાળવવું, વાહનથી સંભાળવું. તા. ૨૧, ૨૨, ૨૩ કાર્યબોજ વધતાં ચિંતા વધશે. તા. ૨૪, ૨૫ ધીરજથી કાર્ય કરવું. તા. ૨૬, ૨૭ આરોગ્ય સંભાળવું.



કન્યા (પ.ઠ.ઇ.)

આ સપ્તાહમાં આપને માનસિક શાંતિ અને આનંદનો અનુભવ થશે. નાણાકીય સાહસથી લાભ થાય. મનોબળ જળવાશે. યશ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય તેવા સંજોગોનું નિર્માણ અવશ્ય થશે. સંતાનોના પ્રશ્નોની મૂંઝવણ સપ્તાહના અંતિમ દિવસોમાં ઊભી થવાની શક્યતાઓ ખરી જ. સંયમથી કાર્ય કરવું. તા. ૨૧, ૨૨, ૨૩ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૪, ૨૫ નાણાકીય લાભ થાય તેવા યોગ છે. તા. ૨૬, ૨૭ મૂંઝવણ વધશે.



તુલા (ર.ત.)

આનંદ-ઉલ્લાસમાં દિવસો વ્યતીત થશે. અનેક નવીન તકો મળતાં આનંદ અને ઉત્સાહની લાગણી જન્મશે. આર્થિક દૃષ્ટિએ પણ આ સમય લાભપ્રદ બની શકે તેમ છે. લેવાય તેટલો લાભ અવશ્ય લઈ લેવો. આવકમાં વૃદ્ધિ થશે. સંતાનોના પ્રશ્નોની મૂંઝવણ હળવી થતાં વિશેષ રાહતની અનુભૂતિ થશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૧, ૨૨, ૨૩ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૪, ૨૫ લાભકારક દિવસો. તા. ૨૬, ૨૭ શુભ દિવસો ગણાય.



વૃશ્ચિક (ન.ચ.)

આર્થિક બાબતોની પુનર્રચના કરી વિશેષ લાભ આ સમયગાળામાં આપ અવશ્ય મેળવી શકશો. નાણાભીડના કારણે અટકી પડેલાં કાર્યોને આગળ ધપાવી શકશો. નોકરિયાત વર્ગે ધીરજથી કાર્યભાર સંભાળવો. ધંધાકીય ક્ષેત્રે વિશેષ લાભ મળી શકે તેમ છે. મિલન-મુલાકાત ફળદાયી નીવડશે. પ્રવાસ ટાળવો. તા. ૨૧, ૨૨, ૨૩ લાભપ્રદ દિવસો ગણાય. તા. ૨૪, ૨૫ અટવાયેલાં કાર્યો થઈ શકે. તા. ૨૬, ૨૭ સામાન્ય દિવસો, પ્રવાસ ટાળવો.



ધન (ભ.ધ.ફ.ટ.)

આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. અણધારી માનસિક વિટંબણાઓ ઊભી થવાની શક્યતા પણ ખરી જ. અશાંતિનાં વાદળો ઘેરાતાં જણાશે. સપ્તાહના અંતિમ દિવસોમાં આવકવૃદ્ધિનાં નવાં સાધનો ઊભાં થતાં નાણાકીય પરિસ્થિતિ સુધરવા પામશે. મન પ્રકૃત્વિત રહેશે. તા. ૨૧, ૨૨, ૨૩ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૪, ૨૫ માનસિક વિટંબણાઓ વધશે. તા. ૨૬, ૨૭ આર્થિક લાભ થાય.



મકર (ખ.જ.)

આ સપ્તાહમાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. સમય અશાંતિજનક જણાય છે. માનસિક આયોગ વધતો જણાય. ઉત્પાત્ત પણ વધવા પામે. ખાસ કરીને જમીન મકાન કે સંપત્તિના પ્રશ્નો અંગે મુશ્કેલી જણાશે. દામ્પત્યજીવનમાં પણ સમસ્યાઓ અને ઘર્ષણ વધે તેમ છે. સંભાળવું પડશે. તા. ૨૧, ૨૨, ૨૩ દરેક રીતે સંભાળવું પડશે. તા. ૨૪, ૨૫ ચિંતાજનક દિવસો ગણાય. તા. ૨૬, ૨૭ સંયમથી કાર્ય કરવું.



કુંભ (ગ.શ.સ.ષ.)

આપના મનની ઈચ્છાઓ પૂર્ણ થવા આડે વિઘ્નો આવશે. પ્રયત્નો વધારશો તો કામ બનશે. આવેશ-આવેગ અને ક્રોધ પર કાબૂ રાખવો જરૂરી જણાય છે. સપ્તાહના અંતિમ ચરણમાં વ્યવસાય નોકરીના પ્રશ્નોમાં રાહત જણાશે. પ્રેમ-રોમાન્સ માટે સમય પ્રતિકૂળ છે, ખાસ સંભાળવું. તા. ૨૧, ૨૨, ૨૩ નિરાશાજનક દિવસો ગણાય. તા. ૨૪, ૨૫ પ્રયત્નોથી લાભ થાય. તા. ૨૬, ૨૭ કંઈક રાહત થાય.



મીન (દ.ચ.ઝ.થ.)

આ સપ્તાહમાં આરોગ્યની કાળજી વિશેષ રાખવી પડશે. નાણાકીય સાહસથી પણ દૂર રહેવું હિતાવહ બની રહેશે. હિતશત્રુઓ અવરોધો ઊભા કરશે. તેને આપ નિષ્ફળ બનાવી શકશો. નાણાકીય સાહસથી દૂર રહેવું. દરેક નિર્ણયો સાવધાનીપૂર્વક લેવા હિતાવહ જણાય છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૧, ૨૨, ૨૩ આરોગ્યની કાળજી રાખવી. તા. ૨૪, ૨૫ રાહત થાય એવા સમાચાર પ્રાપ્ત થશે. તા. ૨૬, ૨૭ સાવધાનીપૂર્વક નિર્ણયો લેવા.

અનિલ કે. ભટ્ટ - મોબાઇલ: ૯૮૯૮૧ ૯૪૫૪૨

૧૧/એ, 'શાંતાકાર', ફાલ્ગુન સોસાયટી, શુભદા કોલોની સામે, બેઘપુર ચાર રસ્તા, સેટેલાઈટ રોડ, અમદાવાદ.